

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટને સ્થાનિક કલાકારો અને નફો ન રળનારી સંસ્થાઓને સહાયતા કરવા અનુદાન (ગ્રાન્ટ) અરજીઓ મેળવવાનું શરૂ કર્યું

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 4, 2021) – આજથી શરૂ કરીને, સીટી ઓફ બ્રેમ્પટન મહત્વપૂર્ણ કાર્યક્રમો અને સેવાઓ વિતરિત કરવા બ્રેમ્પટન-સ્થિત નફો ન રળનારી સંસ્થાઓને સહાયતા કરવા એક ગ્રાન્ટ અને બીજી ગ્રાન્ટ સ્થાનિક કલાકારોને COVID-19 વૈશ્વિક મહામારીમાંથી રિકવર થવામાં મદદરૂપ થવા, એમ બે સામુદાયિક ગ્રાન્ટ તકો માટે અરજીઓ સ્વીકારી રહ્યું છે.

એડવાન્સ બ્રેમ્પટન ફંડ

\$600,000 સામુદાયિક ગ્રાન્ટ કાર્યક્રમ પાત્રતા ધરાવતી બ્રેમ્પટન-સ્થિત નફો ન રળનારી અથવા ધર્માદા સંસ્થાઓને ભંડોળ પૂરું પાડે છે જેથી તેઓ સમુદાયની જરૂરિયાતોને પહોંચી વળતા કાર્યક્રમો અને સેવાઓ આપી શકે.

ત્રણ ભંડોળ પ્રવાહો છે:

- **ઊભરી રહેલો (ઈમર્જીંગ)** - નવા અને નવીન પ્રોજેક્ટ્સ માટે \$5,000 જેટલું અનુરૂપ ભંડોળ પૂરું પાડે છે. આ પ્રવાહ ઓક્ટોબર 4 થી 29 સુધી ખુલ્લો છે.
- **વિકાસશીલ (ડેવલપિંગ)** - બ્રેમ્પટનમાં ઓછામાં ઓછો એક વખત ચાલ્યો હોય તેવા કાર્યક્રમો માટે \$12,500 જેટલું ભંડોળ પૂરું પાડે છે. આ પ્રવાહ ઓક્ટોબર 4 થી નવેમ્બર 29 સુધી ખુલ્લો છે.
- **વિસ્તરણ (એમ્પ્લિફાઈંગ)** - બ્રેમ્પટનમાં ઓછામાં ઓછો બે વખત ચાલ્યો હોય તેવા પ્રોજેક્ટ્સ માટે \$25,000 જેટલું ભંડોળ પૂરું પાડે છે. આ પ્રવાહ ઓક્ટોબર 4 થી નવેમ્બર 29 સુધી ખુલ્લો છે.

ભંડોળના તમામ પ્રવાહો માટેની અરજીઓ વર્ષ 2022 માં થનારા પ્રોજેક્ટ્સને સંબંધિત રહેશે. સમાવિષ્ટ નફો ન રળતી સંસ્થાઓ, નોંધાયેલી ધર્માદા સંસ્થાઓ અને, ઊભરી રહેલો પ્રવાહ, અસંગઠિત નફો ન રળનારા સમૂહો સહિત, બ્રેમ્પટન રહેવાસીઓ માટે સેવાઓ પૂરી પાડનાર માટે ગ્રાન્ટ્સ ખુલ્લી મૂકવામાં આવી છે. દરેક ભંડોળ પ્રવાહો માટે, અરજદારોએ [કાઉન્સિલની અગ્રતાની એ પરિભાષા](#) પસંદ કરવી રહી જે તેઓના પ્રોજેક્ટને શ્રેષ્ઠતમ અનુરૂપ હોય.

રસ ધરાવતી સંસ્થાઓને અરજી પ્રક્રિયા પર વર્ચ્યુઅલ માહિતી સત્રોમાં હાજર રહેવા આમંત્રિત કરવામાં આવે છે:

- ઓક્ટોબર 7 – ઈમર્જીંગ ફંડ માહિતી સત્ર
- ઓક્ટોબર 14 – ડેવલપિંગ ફંડ માહિતી સત્ર
- ઓક્ટોબર 21 – એમ્પ્લિફાઈંગ ફંડ માહિતી સત્ર

સ્થાનિક નફો ન રળનારી અને ધર્માદા સંસ્થાઓને વધુ સહાયતા કરવા, એડવાન્સ બ્રેમ્પટન ફંડ રાયરસન યુનિવર્સિટીની જી. રેમન્ડ યાન્ગ સ્કૂલ ઓફ કન્ટિન્યુઈંગ એજ્યુકેશન સાથે ભાગીદારી કરી છે જેઓ નફો ન રળનારા ક્ષેત્રના વિકાસ માટે વર્કશોપ્સ ચલાવશે જે સંસ્થાઓને તેઓની ક્ષમતા વિસ્તારવા અને જે તે ક્ષેત્રનું શિક્ષણ અને આવડતો ઊભી કરવામાં મદદ કરવા પર ધ્યાન આપશે. વર્કશોપ્સ નવેમ્બરમાં ચાલશે. વિગતો વેબસાઈટ પર છે, brampton.ca/abf

કલાકારો માટે નવું COVID-19 રિકવરી ફંડ

આ વર્ષે નવું, સીટી ઓફ બ્રેમ્પટન અને [આર્ટ્સ, કલ્ચર એન્ડ ક્રિએટિવ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એજન્સી](#) (ACCIDA) ને કલાકારો માટે COVID-19 રિકવરી ફંડ શરૂ કરવામાં ખુશી થાય છે, આ એક અજોડ કાર્યક્રમ ઓન્ટેરિયોમાં મહામારીમાંથી રિઓપન અને રિકવર થવાની શરૂઆત થઈ રહી છે ત્યારે બ્રેમ્પટનના રચનાત્મક ક્ષેત્રને સહાયરૂપ થશે. આ કાર્યક્રમ કલાકારો અને કળા સંસ્થાઓ માટે વર્ષ 2020 નાં COVID-19 રિલિફ ફંડનું વિસ્તરણ છે.

એકલદોકલ કલાકારો મહામારીના પગલે પોતાની રચનાત્મક પ્રથાને સ્થિરતા આપવા, અનુકૂળ બનવા, કે પુનઃનિર્માણમાં મદદ માટે \$2,000 સુધી મેળવવા અરજી કરી શકે છે. એકલદોકલ કલાકારોની અરજીઓ ઓક્ટોબર 4 થી શરૂ કરીને કાં તો વર્ષ 2021 નાં અંત સુધી અથવા તો ઉપલબ્ધ ભંડોળ પૂરું થાય ત્યાં સુધી સ્વીકારવાનું અવિરત ધોરણે ચાલુ રહેશે. ઉપલબ્ધ ભંડોળની કુલ રકમ \$100,000 છે.

માહિતી સત્રો અરજી જરૂરિયાતોની સમીક્ષા કરવા કલાકારો અને સંબંધિત અરજીકર્તાઓ માટે પણ યોજવામાં આવશે. વિગતો [અહીં](#) છે.

- શુક્રવાર, ઓક્ટોબર 22, સાંજે 06:30 થી રાત્રે 8 વાગ્યા સુધી
- સોમવાર, નવેમ્બર 22, સાંજે 06:30 થી રાત્રે 8 વાગ્યા સુધી

બ્રેમ્પટનમાં વિકાસશીલ રચનાત્મક કારકિર્દીઓ

સ્થાનિક કલાકારોને વધુ સહાયતા કરવા, [WorkInCulture](#) (વર્ક-ઇન-કલ્ચર) સાથેની ભાગીદારીમાં ACCIDA *ગ્રોઇંગ ક્રિએટિવ કેરીયર્સ ઈન બ્રેમ્પટન* વર્કશોપ રજૂ કરશે, જે કલાકારો અને કળા ક્ષેત્રના કામદારો માટે મફત વ્યાપક 10-સત્રનો વ્યવસાયિક વિકાસ વર્કશોપ ચલાવશે. દર અઠવાડિયે, સહભાગીઓ પાસે પારસ્પરિક આપલે પ્રવૃત્તિઓ, નેટવર્કિંગ તકોમાં ભાગ લેવાની, નિષ્ણાત સલાહ મેળવવાની અને ડ્રોપ-ઇન સત્રોમાં હાજર રહેવાની તક હશે જેથી તેઓ પોતાની રચનાત્મક કારકિર્દીઓને આગળ વધારવા પોતાને જરૂરી સાધનો મેળવી શકે. વિગતો વેબસાઇટ પર જુઓ, [accida.ca](#)

શું અરજી કરવામાં રસ છે?

માહિતી સત્રો માટે નોંધણી કરવા અને વિગતો, પાત્રતા અને એડવાન્સ બ્રેમ્પટન ફંડ અને COVID-19 આર્ટિસ્ટ રિકવરી ફંડ, બંને અરજી માહિતી માટે નોંધણી કરાવવા વેબસાઇટ જુઓ, [brampton.ca/communitygrants](#)

અવતરણો (ક્વોટ્સ):

“અગાઉ ક્યારેય કરતા વધારે હવે, સમુદાયને વધારે સારી રીતે સેવા આપવા અને COVID-19 મહામારીમાંથી રિકવરીમાં મદદ માટે આપણાં કલાકારો અને નફો ન રળનારી સંસ્થાઓને આપણી સહાયતાની જરૂર છે. બ્રેમ્પટન તકો આપતું શહેર છે, અને આપણી નફો ન રળનારી સંસ્થાઓને એડવાન્સ બ્રેમ્પટન ફંડથી મળતો લાભ અને તેની અવિરત સફળતા જોઈને હું ખુશ છું. મને એકલદોકલ કલાકારો માટે આ નવી તક રજૂ કરવામાં પણ ખુશી થાય છે. બ્રેમ્પટનનો રચનાત્મક સુમદાય મહામારીથી નોંધપાત્ર રીતે પ્રભાવિત થયો છે, અને હું આશા રાખું છું કે આ તકથી તેઓને આગળ વધવામાં અને રિકવરી શરૂ કરવામાં મદદ મળશે.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“મને એડવાન્સ બ્રેમ્પટન ફંડ માટે અરજીઓ મેળવવાનો બીજો રાઉન્ડ શરૂ થતો જોવામાં ખુશી થય છે અને હું બ્રેમ્પટનની નફો ન રળનારી બધી સંસ્થાઓને અરજી કરવા પ્રોત્સાહિત કરું છું. નફો ન રળનારા ક્ષેત્ર દ્વારા આપણાં સમુદાય માટે કરાતું કામ આણમોલ છે, ખાસ કરીને આપણે મહામારીથી રિકવર થઈ રહ્યાં છીએ ત્યારે. આ ભંડોળની તક બ્રેમ્પટનને આરોગ્યપ્રદ અને સુરક્ષિત શહેર બનાવવામાં ફાળો આપવામાં મદદરૂપ થાય છે.”

- હરકિરત સિંહ (Harkirat Singh), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10; પ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“મને બહુ ગૌરવ થાય છે કે સીટી ઓફ બ્રેમ્પટન અને આર્ટ્સ, કલ્ચર એન્ડ ક્રિએટિવ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એજન્સી આ ભંડોળની તક આપશે જેનાથી આપણાં કલાકારોને મહામારીમાંથી રિકવર થવા અને ખીલવા જરૂરી મદદ મળી રહેશે. બ્રેમ્પટનના કલાકારો COVID-19 થી નોંધપાત્ર રીતે પ્રભાવિત થયા છે, અને બ્રેમ્પટનની રચનામાં મહત્વ ફાળો આપનાર તરીકે, આ તક સહાયતા માટે ઉપલબ્ધ હોવાનું જોવું ઉત્તમ છે.”

- રોવિના સાન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; ઉપ-પ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન; કાઉન્સિલ પેનલના સભ્ય, આર્ટ્સ, કલ્ચર એન્ડ ક્રિએટિવ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એજન્સી

“સીટી ઓફ બ્રેમ્પટનની સાંસ્કૃતિક સેવાઓની ટીમ કલાકારો માટે એડવાન્સ બ્રેમ્પટન ફંડ અને COVID-19 રિકવરી ફંડ જેવી તકો આપીને આપણાં સમુદાયને સહાયરૂપ થવા સમર્પિત છે. હું આ ભંડોળ પ્રવાહો મેળવવામાં રસ ધરાવતી દરેક વ્યક્તિને માહિતી સત્રોમાં ભાગ લેવા અને પોતાની અરજીઓ રજૂ કરવા પ્રોત્સાહિત કરું છું.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

પ્રભજોત કૈન્થ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca